**Gujarat Pollution Control Board** Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar - 382 010

Tel 079-23232152 Fax 079-23222784 www.gpcb.gujarat.gov.ir PUBLIC NOTICE

It is hereby to inform that as per Ministry of Environment, Forest & Climate Change Government of India, New Delhi vide its Notification no. S.O. 1533(E) dated Septembe 14, 2006. Public Hearing has been fixed for M/s KCIM Polymer Adhesiye LLP fo Proposed Manufacturing of Synthetic Organic Chemicals (1) Pure Acrylate (Poly Methyl Methacrylate-Co-Methacrylic Acid), (2) Paints Binder (Butyl Acrylate Styrene Copolymer, (3) Textile Binder (Poly Methyl Methacrylate-Co-Ethyl Acrylate - (Total Capacity-200 MT/Month), At Survey No. 1810, Nr. Umiya Estate, B/h Gayatr Dairy, Village. Indrad, Ta. Kadi, Dist. Mehsana - 382715, covered under projec category "B" as mentioned in their request application.

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat Pollution

Control Board before the hearing date. Other concerned persons having a plausible stake in environment aspects of the project o activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control

oard in writing before the hearing date. It may be noted that draft Environmental Impact Assessment Report and Executive mary of the Environment Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during

ormal office hours, till the Public Hearing is over.

. District Collector Office, Mehsana.

.District Development Office, Mehsana

. District Industry Centre, Mehsana. .Taluka Development Office, Ta. Kadi, Dist. Mehsana

5. Regional Officer, Integrated Regional Office, Ministry of Environment, Forests and Climate Change, Karmayogi Bhawan, Block-3, F-2 Wing, 5th Floor, Near CH-3 Circle Sector-10A, Gandhinagar, Gujarat-382010.

6. Regional Office, Gujarat Pollution Control Board, Mehsana

H/3, A-Phase I, GIDC Estate, Near GIDC Office, Modhera Road, Mehsana-384002. The District Magistrate/District Collector/Deputy Commissioner or his/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and presid wer the entire public hearing process.

Note:- If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division the District Magistrate/District Collector/Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise an preside over the entire public hearing process). The Public Hearing is scheduled to be held on 09/09/2025 at 10:00 Hrs, Venue: Block No

451, Behind Maruti Inox, Opp. Torrent Pharma, Gayatri Dairy Road, Village. Indrad Ta. Kadi, Dist. Mehsana, Gujarat.

Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandem

Place:Gandhinagar D. M. Thaker Date: 02/08/2025 Member Secretary

) बैंक ऑफ़ बड़ोदा Bank of Baroda

Khodiyar Colony Branch: Air Force Road, Near Khodiyar Temple Khodiyar Colony, Jamnagar, Gujarat

ANNEXURE - I - REDEMPTION NOTICE Notice under Rule 6(2) and/or Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002

Ref. No. Khodiyar Col/2025-26/2 Date: 28.07.2025

1. Mr. Dhaval Jagadishbhai Tank, 2. Mr. Josanben Jagadishbhai Tank Add.: Plot No. 50/2, Pushpak Park - 6, Opp. Ravi Park, Dhinchad Road, Jamnagar

Re: Notice under Rule 6(2) and/or Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act, 2002).

Ref: -1. Demand Notice Dated 10.07.2024 issued u/s 13 (2) of SARFAESI Act 2002. 2. Possession Notice Dated 23.04.2025 issued u/s 13 (4) of SARFAESI Act 2002. Dear Sir / Medam.

Whereas the Authorised Officer of the Bank of Baroda, Khodiyar Colony Branch Address: Air Force Road, Near Khodiyar Temple, Khodiyar Colony, Jamnagar, Gujara being Secured Creditor Bank in exercise of the powers conferred u/s 13(2) of the SARFAESI Act 2002 (hereinafter refereed as "Act") read with Rules 3 of Security Interest (Enforcement) Rules 2002 (hereinafter refereed as "Rules") issued Demand Notice Dated 10.07.2024 calling upon you being Borrowers (s)/ Mortgagor (s) / Guarantor (s) to repay the amount stated in the said demand notice within 60 days from receipt of said

And whereas you have failed to repay the amount, the undersigned in exercise of the powers conferred u/s 13(4) of the said Act read with Rule 4 and/or Rule 8 of the Rules have taken over the Possession of Secured Assets (hereinafter referred as the said properties) nore particularly described herein below Schedule. Copy of Possession Notice Dated 23.04.2025 is attached herewith for ready reference

Even after taking possession of the secured asset, you have not paid the amount due to Bank as mentioned in above Possession Notice. Your attention is invited to the provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the secured assets.

Therefore you all are requested to pay the dues as mentioned in possession notice along with applicable interest, cost, charges & expenses within 30 days from receipt of this notice and redeem the secured asset as mentioned below. In case you fail to pay the above mentioned dues & redeem the secured asset within 30 days from receipt of this notice, Bank will be constrained to sell the secured asset through public e-Auction by publication of e-Auction Sale notice. The date, time of e-auction and Reserve Price of the property shall be informed to you separately

Schedule of Secured Assets / Properties

Sr. No Description of the Movable / Immovable Properties

Sub Plot No. 50/2, Admeasuring 46.50 Sq. Mt. Land Area of a main amalgamated Plot No. 50 amalgamation of Plot No. 50 to 59 of N.A. Land for Residential Purpose, bearing R.S. No. 33/2/p1/p2 of Village Dhinchada, together with construction of Residential Building Admeasuring 29.88 Sq. Meters thereon situated in the area known as Pushpak Park - 6, Dhinchada, Jamnagar, Ta. Jamnagar, Dist. Jamnagar, Gujarat, Bounded: North: Sub Plot No. 50/3, South Sub Plot No. 50/1, **East**: 7.50 Mtr. Wide Road, **West**: Common Plot

Date of Possession: 23.04.2025, Type of Possession (Symbolic / Physical): Symbolic Date of Publication of Possession Notice (For Immovable Property only): 25.04.2025 Date: 28.07.2025, Place: Jamnagar Sd/- Authorised Officer, Bank of Baroda केनरा बैंक Canara Bank 📣

CANARA BANK - ANKLESHWAR CITY BRANCH 3A, Ground Floor, Godhani Arcade Behind GIDC 500 Quarters, Garden City Ankleshwar, Post Office: Ankleshwar IE S.O

**POSSESSION NOTICE** (For Immovable Property Appendix IV under the Act - Rule 8(1)

The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of power conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 26/05/2025 calling upon the borrower/surety/owner MR/Mrs/M/s Rakesh Gayaprasad Varma 13 Gajanand Society Near Gayatri Mandir Ankleshwar Bharuch Guiarat 393001 and Kaial 13 Gaianand Society Near Gayatri Mandir Ankleshwa Bharuch Gujarat 393001 to repay the amount mentioned in the notice being Rs. 30,41,674.00 (Rs. Thirty Lac Forty- one Thousand Six Hundred Seventy-Four only) within 60 days from the date of receipt of the said notice. The borrower having ailed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has take Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 2nd day of August 2025.

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs. 30,41,674.00 (Rs. Thirty Lac Forty-one Thousand Six Hundred Seventy-Four only) and interest thereon.

The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the ecured assets

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

EMT of all the piece and parcel of residential house/non agricultural plot of land in Mauje Jitali bharuch, R.S. NO. 380, paikki after promulgation new revenue survey no. 490., s no. 380 pakki 2 after promulgation new revenue survey no. 489 pakii "D8" type plot D8-111 (as per sanction plan plot no. A-47) known as "Garden City" admeasuring 1446.67 sq fts/134.40 sq mtr build up area 947.76 sq. fts at sub district Ankleshwar, Distrct- Bharuch, (Security Id-400078249891), Property Owned by- Rakesh ayaprasad Varma and Kajal. Boundaries are as: Bounded as (as per place): North: Plot no D8-112 South: Block/survey io.491 East: Society Road, West: Plot no D8-110. And (as per Plan) North: Plot no A-48, South: Block/survey no. 491, East Society Road, West: Plot no. A-74.

Date: 06.08.2025 **Authorised Officer** Place: Ankleshwar

Canara Bank

Pa Muthoot Homefin

**Business Standard** 



### SPUMBA CONNECTS WITH ETECH AVP

Department of Business Management, engagement from students. Sardar Patel University, hosted a guest session by Mrs Jenny Benoy, AVP - HR at Etech Global Services, under the esteemed leadership of Director Dr Darshana Dave. The session was facilitated by alumnus Mr Anirudh Menon, who continues to play a valuable role in connecting students with industry insights and opportunities. Mrs Benoy delivered impactful inputs addressing engaged workplace culture, organizational red flags, and the importance of adaptability and accountability. She highlighted the importance of the trust triangle, along with integrity and humility, as drivers of organizational growth. Her interactive

On 26th July 2025, the Postgraduate approach welcomed active participation and

The session was well-received for its practical value and relevance to evolving workplace dynamics. Such initiatives bridge academic learning with expectations, preparing students for meaningful careers in a competitive business environment

Campus Reporter - Sakshi Singh



#### **CAREER GROWTH INSIGHTS FROM ADANI EXPERT**

students to enhance their professional development of its budding professionals. journey, emphasizing the importance of skill development, industry engagement, and networking to maximize the return on investment of their education. Drawing from his rich experience in the sports marketing

SJPI College successfully hosted an expert industry, he inspired students to adopt a session on "From Classroom to Career: proactive approach towards career planning. Maximizing ROI at SJPI" on 2nd August The interactive session provided first-year 2025, as part of its Semester 1 Skill Building students with actionable insights and Program. The session was conducted by Mr motivated them to align their academic Giriraj Jadeja, Sports Marketing Head, Adani learning with industry expectations. SJPI Group, and a distinguished alumnus of SJPI College extends its gratitude to Mr Jadeia for Mr Jadeja shared practical strategies for his valuable contribution to the growth and



## **CKSVIM HOSTS YOUNG INDIANS PARLIAMENT**

Voices. Let Yours Be Heard," the event the future. aimed to empower school students and encourage civic participation. Leading schools from Vadodara participated, including Tejas Vidyalaya, Baroda High School, Podar World School, and more. CKSVIM's involvement reflected its dedication to value-based education and

SMJV's CK Shah Vijapurwala Institute of youth leadership development. The institute Management (CKSVIM) proudly partnered was honoured to support an initiative that as the Venue for the Young Indians (Yi) brings academia and industry together for a Parliament, held on August 1-2 in social cause. The two-day event fostered collaboration with Yi, CII, and Bharat Rising. dialogue, leadership, and inspiration, With the theme "The Nation Needs New creating a platform for young voices to shape



र्जनरा बैंक Canara Bank 🕸 सिंडिकेटबैंक Syndicate

Canara Bank - Vadodara Subhanpura Branch POSS SSION NOTIO: Shop No. 4.5.6 Aakar Complex, Samta Char Rasta. (For Immovable F Subhannura, Vadodara-390023 Appendix IV under the Act - Rule 8(1)

Whereas, The undersigned being the Authorised Officer of Canara Bank under the Securitisation and Reconstruction o Financial Asset and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (herein after referred to as "Act") and in exercise f powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued **Demand** Notice dated: 04/03/2025 calling upon the 1. Mrs. Kirtiben Gaurangbhai Padhiyar 2. Mr. Sureshbhai Mohanbhai Padhiyai Borrower) 3. Mr. Gaurang Sureshbhai Padhiyar (Borrower) amount mentioned in the notice being Rs. 13,48,394.53 (Rs. Thirteen Lakes Forty-Eight Thousand Three Hundred Ninety-Four and Fifty-Three Paisa Only), plus interest and charges ereon less recovery (if any), within 60 days from the date of notice.

The Borrower/ Guarantor / Legal Heir having failed to repay the amount, notice is hereby given to the Borrower & Guarantor 8 Legal Heir and the public in general that the undersigned has taken Physical Possession of the property being described perein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 & 9 of the security Interest Enforcement Rules of the said Act and in compliance of Hon'ble Chief Judicial Magistrate At Vadodara Order Dated 08/07/2025 n Case No. 4503/2025 under Section 14 of the said Act on the **28.07.2025**.

The Borrower/ Guarantor/Mortgager/Legal Heir in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the of Canara Bank for an amount of Rs. 13,48,394.53 (Rs. Thirteen Lakes Forty-Eight Thousand Three Hundred Ninety-Four and Fifty-Three Paisa Only), plus interest and narges thereon less recovery (if any).

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time vailable, to redeem the secured assets

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY** 

All the piece and parcel of the property being: Non- agricultural plot of property in moje Gorwa Vadodara lying being land bearing RS No. 146, 148, 150, 151, 152, 153 & 154, C.S. No. 3704/1, 3704/2, 3704/3, 3706, 3709, 3710, 3722 known as Samata Co. Op. Housing Society Ltd. paikki Flat No. B-1/99 Block No.1, Tower-B, on Ground Floor, construction adm. area 84 sq.mtrs. Vadodara Gujarat in the registration district of Vadodara and Sub-Dist. of Vadodara (Gorwa). Having Boundaries are as: East: By common passage, West: Open land, North: Flat no. 100, South: Open land.

Authorised Officer, Canara Bank Date: 05.08.2025, Place: Vadodara

Muthoot Homefin (India) Ltd.

POSSESSION NOTICE (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. (MHIL) under the Securitisatio and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2)read with Rule 3 of the Security Interest(Enforcement) Rules 2002, Demand Notice(s)issued by the Authorised Officer of the company to the Borrower(s)/ Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Muthoot Homefin (India) Ltd. for an amount as mentioned herein under with interest thereon

The Borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to

		Notice & Total Outstanding Dues (Rs.)	Possession Taken Da	
Arjanbhai Jethabhai Khant/ Kapilaben Arjanbhai Khant/ 004- 00403917/ Surat	Flat No. 208, 2nd Floor Kamdhenu Residency Soni Park Housing Society 2, Tatithaya Palsana Surat, Pincode- 394305	30-Sep-2021/Rs. 3,48,181/- (Rupees Three Lakh Fourty Eight Thousand One Hundred Eighty One Only.)	03-08- 2025	
Devendra Shamraoji Khavele/ Ranjanaben Devendra Khavele/ 004-00401481/ Surat	Plot No. 17, Mahadev Residency 1, R.S. No. 44, 45, 498, 498/5, 299/1, 499/2, 299/3, 499/4, 499/6 Block No.67/A, Surat Bardoli Road, Landmark Behind VK Park Residency, Tathi Thaya, Surat Pin Code 394305 North: Plot No.18, South: Plot No.16, East: Plot No.28, West: Society Internal Road	20-Jan-2025/Rs. 9,21,985/- (Rupees Nine Lakh Twenty One Thousand Nine Hundred Eighty Five Only)	03-08 2025	
Dudhnath Rajmangal Thakur/ Miradevi Dudhnath Thakur/ 004-00403649/ Surat	302 3Rd Floor Shree Balaji Flat Vallabhnagar Near Blue Date School Surat Surat Gujarat 394140	20-Jan-2025/Rs. 3,99,126/- (Rupees Three Lakh Ninety Nine Thousand One Hundred Twenty Six Only.)	03-08 2025	
Jitendra Prakash Adhav/ Monika Jitendra Adhav/ 004-00000813/ Surat	20-Jan-2025/Rs. 7,53,506/- (Rupees Seven Lakh Fifty Three Thousand Five Hundred Six Only.)	03-08 2025		
Krishana Sitaram Khalane/ Sarla Krishna Khalane/ 004-00405076/ Surat	Flat No. 106, 1st Floor, Shivdhara Residency, Gokul Dham Villa, Off Surat Bardoli Highway Palsana, Surat, Surat, Gujarat, 394305	10-Sep-2019/Rs.7,81,339/- (Rupees Seven Lakh Eighty One Thousand Three Hundred Thirty Nine Only.)	03-08 2025	
layka/ Gitaben Annojbhai Nayaka/ 04-00404123/ Surat  394305. More Perticularly Mentioned In The Sale Dee Registered No. 8908/2018, Dated- 04/06/2018. In The office of Sub Registrar Palsana Having Boundaries-		26-Dec-2020/ Rs. 6,13,963/- (Rupees Six Lakh Thirteen Thousand Nine Hundred Sixty Three Only.)	03-08 2025	
Narayan Abhiman Pote/ Bharti Narayan Pote/ 004-00403742/ Surat	10-Sep-2019/Rs. 6,34,310/- (Rupees Six Lakh Thirty Four Thousand Three Hundred Ten Only.)	03-08 2025		
Radheshyam Nanku Kanojiya/ Sita Radheshyam Kanojiya/ 004-00402559/ Surat	Anojiya/ Sita Nagar, Surat Kadodara Road, Vareli, Palsana, Surat Sadheshyam Kanojiya/ Survey No. Block No. 121 Landmark Blue Daine School O4-00402559/ Surat District Surat State Gujrat Pincode 394305 Directions North- Adj. Plot No.134, South- Adj. Plot No.138, East-		03-08 2025	
Ramjit Abhaynarayan Dubey/ Bindudevi Ramjit Dubey/ 004-00404580/ Surat In The Office of Sub Registrar Palsana Having Boundaries- North- Adj Society Road, South- Adj  Flat No. 404 4th Floor Sahajanand Residency - 2, Soni Park Housing Society off Surat Bardoli Highway Surat (12,11,738/- (Rupee Taylor) 12,11,738/- (Rupe		12,11,738/- (Rupees Twelve Lakh Eleven Thousand Seven Hundred Thirty Eight	03-08 2025	
Rupesh Lalay Pandey/ Sonidevi Rupesh Pandey/ 004- 00402336/ Surat	onidevi Rupesh Society Society, off Surat Bardoli Highway, Tatithaya, Palsana, Surat Survey No. Block No. 2 Landmark		03-08 2025	
Madhuri Vinod Thakur/ 004-00404679/ Surat		10-Sep-2019/Rs. 8,79,508/- (Rupees Eight Lakh Seventy Nine Thousand Five Hundred Eight Only.)	03-08 2025	
	Devendra Shamraoji Khavele/ Ranjanaben Devendra Khavele/ 004-00401481/ Surat  Dudhnath Rajmangal Thakur/ Miradevi Dudhnath Thakur/ 004-00403649/ Surat  Jitendra Prakash Adhav/ Monika Jitendra Adhav/ 004-00000813/ Surat  Krishana Sitaram Khalane/ Sarla Krishna Khalane/ Sarla Krishna Khalane/ Surat  Manojbhai Bachubhai Nayka/ Gitaben Manojbhai Bachubhai Nayka/ Gitaben Manojbhai Nayaka/ 004-00402123/ Surat  Narayan Abhiman Pote/ Bharti Narayan Pote/ 004-00403742/ Surat  Radheshyam Nanku Kanojiya/ Sita Radheshyam Kanojiya/ 004-00402559/ Surat  Ramjit Abhaynarayan Dubey/ Bindudevi Ramjit Dubey/ 004-00404580/ Surat  Rupesh Lalay Pandey/ Sonidevi Rupesh Pandey/ 004- Vinod Maharu Thakur/ Madhuri Vinod Thakur/	Devendra Shamraoji Khavele/ Ranjanaben Devendra Khavele/ Ranjanaben Devendra Khavele/ Roud-00401481/ Surat Devendra Khavele/ Roud-00401481/ Surat Berdoli Road, Landmark Blick No.67/A, Surat Bardoli Road, Landmark Behind VK Park Residency, Tathi Thaya, Surat Pin Code 394305 North: Plot No.18, South: Plot No.16, East: Plot No.28, West: Society Internal Road Dudhnath Thakur/, 004-00403649/ Surat Burdoli Marking Blie Date School Surat Surat Gujarat 394140 Dudharath Thakur/, 004-00403649/ Surat Blie Date School Surat Surat Gujarat 394140 Date School Surat Surat Flot No.332, West: Plot No.330, 331, Chathan Railway Station, Palsana, Pincode 395304 North: Rec Road, South: Plot No.332, West: Plot No.332, Surat, Surat, Gujarat 394305 More Perticularly Mentioned In The Sale Deed Registered No. 8098/2018, Dated-04/06/2018. In The Office of Sub Registrar Palsana Having Boundaries-North-Adj. Plot No. 184, 185, 186, West- Adj. Society Road Surat Surat State Gujarat State Gujarat Pincode 394305 Directions North-Adj. Plot No.134, South-Adj. Plot No. 138, Surat State Gujarat Pincode 394305 Directions North-Adj. Plot No.134, Society Road Society Society, of Surat Bardoli Highway, Surat Sale Deed Registered No. 11764, Dated: 23/05/2018. In The Office of Sub Registrar Palsana Having Boundaries-North-Adj Blot North-Adj. Plot No.138, Society Road Society Society, of Surat Bardoli Highway	Devendra Shamraoji Khavele/ Ranjanabeb Devendra Khavele/ 004-00401481/ Surat Devendra Khavele/ 004-00401481/ Surat Behind VK Park Residency, Tathi Thaya, Surat Pin Code 394305 North: Plot No.18, South: Plot No.16, East: Plot No.28, West: Society Internal Road Dudhnath Rajmangal Thakur/ Miradevi Dudhnath Thakur/ 004-0040549/ Surat  Jittendra Prakash Adhav/ Monika Jittendra Adhav/ 004-00400343/ Surat  Jittendra Adhav/ 004-00000813/ Surat  Jittendra Adhav/ Nonika Jittendra Adhav/ 004-00000813/ Surat  Flat No.401, Building Name: 4th Floor Sai Lakshmi Residency, Block No.183, Plot No.334, 331, Chathan Railway Station, Palsana, Pincode 395304 North: Rcc Road, South: Plot No. 334/335, East: Plot No.332, West: Plot No.323, West: Plot No.323, West: Plot No.323, West: Plot No.323, West: Society Internal Road  John Maria Thakur/ 004-00400549/ Surat  Flat No.401, Building Name: 4th Floor Sai Lakshmi Residency, Block No.183, Plot No.3343, Sast: Plot No.332, West: Plot No.333, Sast: Plot No.332, West: Plot No.333, Sast: Plot No.332, West: Plot No.334, Sast: Plot No.332, West: Plot No.334, Sast: Plot No.332, West: Plot No.304, Sast: Plot No.334, Sast	

THOFC BANK We understand your world

Date: 05.08.2025

## **HDFC Bank Limited**

Branch: HDFC House, Near Mithakali Six Lane Road, Navrangpura Ahmedabad-380009. Tel: 079-26563379

**POSSESSION** NOTICE

For HDFC Bank Ltd.

Whereas the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC), under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("said Act") and in exercise of powers conferred under Section13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their res at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc till the date of payment and / or realisation.

uie c	ne date of payment and 7 of realisation.							
Sr. No.	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues	Date of Demand Notice	Date of Possession	Description of Immovable Property (ies) / Secured Asset (s)			
Α	В	С	D	E	F			
1	MR. RABARI DEVAJIBHAI (Borrower) MRS. RABARI BHAVNABEN (Co-borrower)	Rs. 10,61,143/- and Rs. 71,647/- respectively dues as on 30-SEP-24*	12-Nov-2024	03-AUG-25 (Physical Possession)	UNIT-D/309, 310, FLOOR-3 SHUKAN AVENUE BLK D PLOT FP 191, S NO 1008, OPP SINDBAD HOTEL, MEHASANA - AHMEDABAD HIGHWAY, KALOL, AHMEDABAD: 382721			
2	MR. SANGHAVI MILAN MAHADEV (Borrower) MRS SANGHVI NEHABEN MILANBHAI (Co-borrower)	Rs. 15,90,457/- and Rs. 1,26,931/- dues respectively as on 30-JUN-24*	13-Aug-2024	03-AUG-25 (Physical Possession)	FLAT-E-3/108, FLOOR-1 LAKE VIEW RESIDENCY - E3 (E T S. NO: 348/1/P1, OPP GURUDWARA, OPP ST MARY`S SCHOOL SILVASSA-VAPI MAIN ROAD DUNGRA, VAPI: 396195			
3	MR DESAI MAHESHBHAI (Borrower)	Rs. 8,92,687/-and Rs. 31,426/- dues respectively as on 28-FEB-25*	i i	01-AUG-25 (Symbolic Possession)	FLAT-P/504, FLOOR-5 <sup>TH</sup> , GUJARAT HOUSING BOARD - 1228 LIG 2 GOTA PLOT FP27+32, 86, S NO 72+73+74 AND OTHERS, TP-57 (OGNAJ), PLOT NO. A(PH-1), PLOT B(PH-2), PLOT C, VASANTNAGAR TOWNSHIP GOTA -OGNAJ ROAD, AHMEDABAD- 382481			
4	MR GUPTA PRIYADARSHI (Borrower) MRS GUPTA SHRUTI (Co-borrower)	Rs. 15,65,976/- and Rs. 69,157/- dues respectively as on 28-FEB-25*	27-Mar-25	01-AUG-25 (Symbolic Possession)	FLAT-M1/B/1104, FLOOR-11, GUJARAT HOUSING BOARD MIG-1 GOTA PLOT FP27+32, 86, S NO 72+73+74 AND OTHERS, TP-57(OGNAJ), PLOT NO. A(PH-1), PLOT B(PH-2), PLOT C, VASANTNAGAR TOWNSHIP GOTA OGNAJ ROAD, AHMEDABAD- 382481			
5	MR PATEL YOGESH (Borrower) MRS PATEL B CHETNABEN (POA Holder)	Rs. 13,39,511/- dues as on 28- FEB-25*	26-Mar-25	01-AUG-25 (Symbolic Possession)	FLAT-G-103, FLOOR-1 <sup>ST</sup> , AAKRUTI ELEGANCE - BLOCK G PLOT FP36, UNIT TP65, S NO 24, SP NO 36/1&36/2, NR GODREJ GARDEN CITY, BEHIND NIRMA UNIVERSITY OFF SG HIGHWAY TRAGAD, CHANDLODIA, AHMEDABAD- 383255			

\*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorised Officer/s of HDFC have taken physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of

powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above. The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect o time available to redeem the secured asset/s. Conies of the Phachnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal

Representative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Place : Gujarat **Authorised Officer** Regd Office: HDFC Bank Ltd. HDF Bank House, Senapati Bapat Marg. Lower Parel (West). Mumbai-400013. CIN: L65920MH1994PLC080618 Website: www.hdfcbank.com

# SHREE RAMA MULTI-TECH LIMIT

Regd. Office: Block No. 1557, Village - Moti-Bhoyan, Kalol-Khatraj Road, Taluka - Kalol, Gandhinagar, Gujarat, 382721. Website: www.srmtl.com, Email: cslegal@srmtl.com, CIN No. L25200GJ1993PLC020880

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2025

(Rs. in lakhs Except EPS)

Sr.No	Particulars	Quarter ended 30/06/2025 (Unaudited)	Quarter ended 31/03/2025 (Audited)	Quarter ended 30/06/2024 (Unaudited)	Year ended 31/03/2025 (Audited)
1	Total Income	5,684.87	5,935.58	4,330.80	20,850.78
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	987.27	708.86	419.77	2,183.80
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	987.27	708.86	419.77	2,183.80
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	734.72	3,659.63	419.77	5,134.57
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	727.96	3,692.72	421.70	5,045.94
6	Equity Share Capital (Face Value Rs.5/- each)	6,673.40	6,673.40	6,673.40	6,673.40
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet	-	•		8,644.44
8	Earnings per Share (Basic & Diluted) (Face Value Rs.5/each)				
	Basic EPS     Diluted EPS	0.53 0.53	2.72 2.72	0.29 0.29	3.76 3.76

- a) The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on August 05, 2025. The statutory auditors of the company have carried out review of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015.
- b) The Unaudited Financial Results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
- c) The above is an extract of the detailed format of Audited Financial Results for Quarter and Year ended 30th June, 2025 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and website of the company (www.srmtl.com).

Place: Moti Bhoyan Date: August 05,2025



By Order of the Board of Directors For, Shree Rama Multi-Tech Limited Shailesh K. Desai **Managing Director** DIN:01783891

સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું



અમદાવાદ,તા.પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઇ રહેલા 'મહાત્મા ગાંધી સાબકરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેકટ'ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

૧૨ માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે 🛮 ટ્રસ્ટ દ્વારા ૫૫ એકરમાં આ રિ-આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટનો ડેવલપમેન્ટ કામગીરી હાથ

કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો. અંદાજે રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી

# પપ એકરમાં રિ-ડેવલપમેન્ટની કામગીરી થઇ રહી છે

વડાપ્રધાનએ ૨૦૨૪માં સાબરમતી આશ્રમ મેમોરિયલ

મુખ્યમંત્રી આ કામગીરી પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય સચિવ પંકજ જોષી સાથે આશ્રમની મુલાકાતે ગયા હતા. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન આઇ.પી. ગૌતમ અને ખાસ ફરજ પરના અધિકારી આઇ.કે. પટેલે મુલાકાત દરમિયાન 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેકટ' અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી

આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.

# રાજ્ય બહારથી આવતી નકલી દવાઓ માટેની ચકાસણી અર્થે સરકાર એસઓપી તૈ

રાજ્યના પ્રત્યેક નાગરિકને ડ્રપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ગુણવત્તાયુકત દવાઓ અને ખોરાક ટોલરન્સ અપનાવનાર ગુજરાત

યુનિટ સતત કાર્યરત છે. તાાજે તારમાં રાજ્યમાં કેટલાક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાં થી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું.

રા જ ય સરકારના ફૂડ એ ન્ડ ડ્ર ગ્સ

વિભાગે સ્થળ ચકાસણી કરીને અટકાવવા માટે દરોડા પાડીને આવા તત્ત્વો સામે કાર્યવાહી પણ આશરે ૬ કરોડથી વધુની દવાઓ,

જેને વધુ સધન અને સખ્ર આવી. બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી ચકાસણી અર્થે સરકાર દ્વારા જેનીસામેકાર્યવાહીકરાઇ. જેમાંથી એસએપી તૈયાર કરવામાં આવનાર મોટાભાગના કિસ્સાઓમાં આવી હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ બનાવટી દવાના ખરીદ વેચાણ પટેલે જણાવ્યું છે.

એસઓપી અમલીકરણ સાથે જોડાયેલ હોય છે તથા તપાસમાં

મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે તેમ મારૂ જૂનું નામ હર્નિશા વિજયકુમાર વિભાગ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ્સ પણ તેમણે ઉમેર્યું હતું. ભાવસાર હતું તે બદલીને નવું નામ ગુજરાતમાં હર્નિશા વિજય ભાવસાર રાખેલ છે.

રાજ્ય બહારની એસઓપીની મુખ્ય બાબતો બિનાવીટી/ પરપ્રાંતીય દવાઓનું સ્પારીસા/ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું, કાઉન્ટરફ્રીટ દવા વહન કરનાર દવા આો અટકાવવાની ટાન્સપોર્ટરોની નોંધણી કરવી, દિશામાં સરકાર કેમિસ્ટ/ હોલસેલર દંડનીય સધન કામગીરી પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના

છેલ્લા ૪ પ્રસાધન ધારાનું કડક પાલન વર્ષમાં રાજ્યમાં કરવું, મોંઘી અને 'Fast Mov-બા-ાાવટી ing' દવાઓ પર ઘનાજિ|દવા આે , કો સ્મેટી ક બાનાાવટો

હાથ ધરશે.

કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં

રદ કરવા, ઔષધ અને સૌંદર્ય

મોનીટરીંગ.

જેમાં આશરે ૭૫ વ્યક્તિ/ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ એ પણ જાણવા મળેલ છે કે, દવાઓ રાજ્ય બહારથી આવતી

સરનામુંઃ એ-૭૬૩, સિમાપાર્ક,

અંબિકાનગર, ઓઢવ

અમદાવાદ

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ શેઠવાલા મોહમ્મદ

અફફાન યુસુફ હતું એ બદલીને નવું

નામ અફફાન યુસુફભાઈ શેઠવાલા

રાખેલ છે. ૯૬૩, ટોકરશાહ પોલ,

ગલી નં. ૧૭, જમાલપુર,

અમદાવાદ-૩૮૦૦૦૧

નામ બદલેલ છે

મેં મારુ જૂનું નામ ઇલ્શા ઉર્ફે હના

રીઝવાન મુન્શીથી બદલીને નવું

નામ હના મોહમ્મદરીઝવાન મુન્શી

કરેલ છે. ૧૧, વેલોસિટી પાર્ક

મકરબા, અમદાવાદ

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ મેમોણ અસમાબાનુ

ઉબેદુલ્લાભાઈથી બદલીને નવું મેમણ

અસ્માબાનુ ઉબેદુલ્લાહભાઈ રાખેલ

છે. સરનામુંઃ ગુલીવાલા છીપા

મસ્જિદ, અનમોલ હોટલની પાછળ,

સરખેજ, અમદાવાદ-૩૮૦૦૫૫

#### મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી હોય છે. નામ બદલેલ છે નામ બદલેલ છે

મારૂ જૂનું નામ વિજયકુમાર નવિનચંન્દ્ર ભાવસાર હતું તે બદલીને નવું નામ વિજય નવિનચંન્દ્ર ભાવસાર રાખેલ છે. સરનામુંઃ એ-૭૬૩, સિમાપાર્ક, અંબિકાનગર, ઓઢવ અમદાવાદ

# નામ બદલેલ છે

નામ બદલેલ છે મેં મારુ જૂનું નામ સાદીયા રીઝવાન મુન્શીથી બદલીને નવું નામ સાદીયા મોહમ્મદરીઝવાન મુન્શી કરેલ છે. ૧૧, વેલોસિટી પાર્ક મકરબા, અમદાવાદ

### કુડાસણ, ગાંધીનગર

નામ બદલેલ છે મેં મારુ જૂનું નામ રીઝવાન મયુદીન મુન્શીથી બદલીને નવું નામ મોહમ્મદરીઝવાન મોઇનુદ્દીન મુન્શી કરેલ છે. ૧૧, વેલોસિટી

મારૂ જૂનું નામ મેમોણ ઉબેદુલ્લાહભાઈથી બદલીને નવું મેમણ ઉબેદુલ્લાહભાઈ રાખેલ છે. સરનામુંઃ ગુલીવાલા છીપા મસ્જિદ, અનમોલ હોટલની પાછળ, સરખેજ,

નામ બદલેલ છે

મારૂ જૂનું નામ મુમતાજહેસન

મહંમદશરીફ શેખથી બદલી નવું

મોહમ્મદ જાકીર મોહમ્મદ શરીફ શેખ

રાખેલ છે. એડ્રેસઃ

૪૪૪, હીરાલાલની ચાલી, ઉષા

ટોકીઝ રોડ, ગોમતીપુર, અમદાવાદ

મેં મારુ જૂનું નામ ચેતનકુમાર

યજ્ઞમૂર્તિ દવેથી બદલીને નવું નામ

ચેતન યજ્ઞમૂર્તિ દવે કરેલ છે.

એફ-૪૦૧, પરિશ્રમ રેસીડેન્સી,

નામ બદલેલ છે

## નામ બદલેલ છે

મારૂ નામ જૂનું સેખ મોબારકથી બદલીને નવું શેખ મુબારક મુખ્તિયાર અલી રાખેલ છે. સરનામું: ૩૭, રહેમત ડુપ્લેક્ષ, રસુલાબાદ, દાણીલીમડા, અમદાવાદ-૩૮૦૦૨૮

પાર્ક મકરબા, અમદાવાદ

# અમદાવાદ-૩૮૦૦૫૫

નામ બદલેલ છે મારૂ જૂનું નામ સુરેશ કિશીનચંદ કરમચંદાનીમાંથી બદલી નવું સુરેશકુમાર કિશનચંદ કરમચંદાની રાખેલ છે. ૨૦૩, બીજો માળ, સ્પર્શ રેસિડેન્સી, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮

ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે 'ગોલ્ડન અવર્સ'માં

# પોલીસનું 'અભિરક્ષક' ઇજાગ્રસ્તોને રેસ્કયુ કરી તેમના જીવ બચાવશે

રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન "અભિરક્ષક" વિહિકલ



ખરીઘાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્ચ્રુ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા

બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી

એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટે કનો લો જીયુ કત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ. આ અભિરક્ષક

વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને "ગોલ્ડન અવર્સ" દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે.

આ વાહન ત્યારે ખૂબ પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા એચઆરડીસીના ડાયરેકટર પાસે ૭૫ લાખ માંગવાના મામલે

# ગુજરાત યુનિ.ના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાનું તાત્કાલિક રાજીનામુ લઈ લેવાયું

સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપી માં હોદ્દો સેન્ટરના ડાયરેકટર પાસેથી ૭૫ સૂત્રોચ્ચાર કરી ૭૫ લાખની હોવાથીકાર્યકરો લાખની માંગ કરી હતી. ડાયરેકટરને પોતાની ઓફિસમાં બોલાવીને યુજીસીમાંથી આવતી ગ્રાન્ટમાંથી ૭૫ લાખ આપવા પડશે એવી વાત કરી હતી. જો આ પૈસા ન આપે તો તેમના ફરિયાદ કરી અહેવાલ માંગવામાં આવશે. એ બાદ તે સભ્ય અને અજ્ય સિન્ડિકેટ સભ્ય તપાસ કમિટીમાં રહીને ડાયરેકટરને જ નહીં અન્ય વ્યક્તિઓ પાસેથી પણ લાખો રૂપિયા લીધા હોવાની

અમદાવાદ, તા. ૫ ફરિયાદ થઈ છે, જેની તપાસ કાર્યકરો ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહી છે.આ મામલે કુલ૫તિની એનએસયુઆઈ યુનિવર્સિટીમાં આજે વિરોધ પહોંચ્યા હતા. ધરાવતી એક વ્યક્તિએ યુનિ.ના નોંધાવવામાં આવ્યો હતો જેમાં જો કે કુલપતિની હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કૂલપતિની ઓફિસ બહાર ઓફિસ બંધ

## એનએસયુઆઈ દ્વારા યુનિ.માં ઉંગ્ર વિરોધ પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ

ડિપાર્ટમેન્ટ વિરૂધ્ધ વિસ્તૃત નકલી નોટો ઉડાવી હતી. આ કાર્યકરો ની પોલીસ અને અટકાયત એનએસયુઆઈ કાર્યકર્તા વચ્ચે કરવાનો પ્રયત્ન ઘર્ષણ થયું હતું. પોલીસે તમામ કર્યો હતો પરંતુ કાર્યકરોની ટીંગાટોળી સાથે તેઓજમીનપર મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ નુ કસાન કરશે. આ અંગે અટકાયત કરી હતી. આ મુદ્દે સૂઈજતાં મહિલા અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ ડાયરેકટર દ્વારા ગુજરાત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પંાે લી સ વાહનના અંદર ફસાઈ ગઈ હોય યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં નિરજા ગુપ્તાએજર્મનીથીસિન્ડિકેટ અધિકારી ઓ અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર આવી છે . ઉલ્ખનીય છે કે બેઠક ઓનલાઈન બોલાવી હતી. અ ન ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા સિન્ડિકેટસભ્યને ડાયરેકટર પાસે આ બેઠકમાં શ્વેતલ સુતરિયાનું કર્મ ચારીઓ ને તાત્કાલિકરાજીનામું લઈ લેવાયું એનએસયુઆઈના છે.ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યકરો ની એનએસયુઆઈઅને યુથ કોંગ્રેસ અટકાયત કરવી દ્વારા ૭૫લાખની માંગણી બાબતે પડી હતી. વિરોધ કરવામાં આવ્યો હતો.

હાથામાં

ખંડણીખો ર એ બીવીપી ખંડણીખો ર

હપ્તાખોર શ્વે તલ

સુતરિયા સહિતના

બેનરો સાથે

માે ટી

દ્વારા ઓફિસ બહાર ઓફિસ બહાર જબેસીને વિરોધ કરી રહૃાા હતા.

> દરમિયાન પાેલીસે

HDFC BANK

એચડીએફસી બેંક લિમિટેડ

શાખા: એચડીએફસી હાઉસ, મીઠાકળી સિક્સ લેન રોડ પાસે, નવરંગપુરા અમદાવાદ-૩૮૦૦૦૯. ટેલ: ૦૭૯-૨૬૫૬૩૩૭૯

પઝેશન નોટિસ

જ્યારે એચડીએફસી બેંક લિમિટેડના ઓથોરાઇઝ્ડ ઓફિસર (અગાઉની એચડીએફસી લિમિટેડે ૧૭ માર્ચ, ૨૦૨૩ ના રોજના આદેશ દ્વારા માનનીય એનસીએલટી -મુંબઇ દ્વારા મંજૂર કરાયેલ જોડાણની યોજનાના આધારે એચડીએફસી બેંક લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું) (એચડીએફસી), સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ("કથિત એક્ટ") હેઠળ અને કલમ ૧૩(૧૨) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુરક્ષા હિત (અમલીકરણ) નિયમો ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વાંચવામાં આવે છે, જેણે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩ (૨) હેઠળ ડિમાન્ડ નોટિસ જારી કરી હતી, જેમાં નીચેના ઋણલેનાર (ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ (ઓ) ને તેમના નામ સામે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરોક્ત નોટિસોમાં ઉલ્લેખ કર્યા મુજબના દરો, ઉપરોક્ત નોટિસોની તારીખથી ૬૦ દિવસની અંદર, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જિસ વગેરે ચુકવણીની તારીખ અને / અથવા અનુભૂતિની તારીખ સુધી.

ક્રમ ન.	ઋણલેનાર (ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓનું નામ	બાકી લેણાં	ડિમાન્ડ નોટિસ તારીખ	કબજાની તારીખ	સ્થાવર મિલકત(ઓ) / સિક્યોર્ડ એસેટ(ઓ) નું વર્ણન એફ			
એ	બી	સી	કી	ઈ				
1	શ્રી રબારી દેવજીભાઈ (ઋણલેનાર) શ્રીમતી રબારી ભાવનાબેન (સહ ઋણલેનાર)	૩૦.૦૯.૨૦૨૪ ના રોજ રૂ. ૧૦,૬૧,૧૪૩/- અને રૂ. ૭૧,૬૪૭/- બાકી	રોજ રૂ. ૧,૧૪૩/- અને પઝેશન પ					
2	શ્રી દેસાઈ મહેશભાઈ (ઋણલેનાર)	૨૮.૦૨.૨૦૨૫ ના રોજ રૂ. ૮,૯૨,૬૮૭/- અને રૂ. ૩૧,૪૨૬/- બાકી		૦૧.૦૮.૨૦૨૫ સિમ્બોલિક પઝેશન	ફ્લેટ-પી/પ૦૪, પમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ - ૧૨૨૮, એલઆઈજી ૨, ગોતા, પ્લોટ એફ પી ૨૭+૩૨, ૮૬, એસ નં. ૭૨+૭૩+૭૪ અને અન્ય, ટી પી ૫૭ (ઓગનાજ), પ્લોટ નં. એ (પીએચ-૧), પ્લોટ બી (પીએચ-૨), પ્લોટ સી, વસંતનગર ટાઉનશીપ ગોતા -ઓગનાજ રોડ, અમદાવાદ- ૩૮૨૪૮૧			
3	શ્રી ગુપ્તા પ્રિયદર્શી (ઋણલેનાર) શ્રીમતી ગુપ્તા શ્રુતિ (સહ ઋણલેનાર)	૨૮.૦૨.૨૦૨૫ ના રોજ રૂ. ૧૫,૬૫,૯૭૬/- અને રૂ. ૬૯,૧૫૭/- બાકી		૦૧.૦૮.૨૦૨૫ સિમ્બોલિક પઝેશન	ફ્લેટ-એમ૧/બી/૧૧૦૪, ૧૧મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમઆઈજી-૧, ગોતા, પ્લોટ એફ પી ૨૭+૩૨, ૮૬, એસ નં. ૭૨+૭૩+૭૪ અને અન્ય, ટી પી ૫૭ (ઓગનાજ), પ્લોટ નં. એ (પીએચ-૧), પ્લોટ બી (પીએચ-૨), પ્લોટ સી, વસંતનગર ટાઉનશીપ, ગોતા ઓગનાજ રોડ, અમદાવાદ- ૩૮૨૪૮૧			
4	શ્રી પટેલ યોગેશ (ઋણલેનાર) શ્રીમતી પટેલ બી ચેતનાબેન (પીઓએ હોલ્ડર)	૨૮.૦૨.૨૦૨૫ ના રોજ રૂ. ૧૩,૩૯,૫૧૧/- બાકી	ર૬.૦૩.૨૦૨૫	૦૧.૦૮.૨૦૨૫ સિમ્બોલિક પઝેશન	ફ્લેટ-જી-૧૦૩, પહેલો માળ, આકૃતિ એલિગન્સ, બ્લોક જી, પ્લોટ એફ પી ૩૬, યુનિટ ટી પી ૬૫, એસ નં. ૨૪, એસ પી નં. ૩૬/૧ અને ૩૬/૨, ગોદરેજ ગાર્ડન સિટી પાસે, નિરમા યુનિવર્સિટીની પાછળ, એસજા હાઇલે ત્રાઝારની બહાર ચાંદલોરિયા અમદાવાદ- ૨૮,૩૨૫૫			

\*લાગુ પડતું હોય તે રીતે વધુ વ્યાજ સાથે, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જ વગેરે ચૂકવણીની તારીખ અને/અથવા પ્રાપ્તિની તારીખ સુધી જો કેં, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) બાકી નીકળતી રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) અને કાનૂની પ્રતિનિધિઓને અને સામાન્ય રીતે જનતાને નોટિસ આપવામાં આવે છે કે એચડીએફસીના અધિકૃત અધિકારી/ઓ એ કલમ ૧૩(૪) હેઠળ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઉપર જણાવેલ સ્થાવર મિલકત (ઓ) / સુરક્ષિત સંપત્તિ (ઓ) નો ભૌતિક કબજો લીધો છે. ઉપરોક્ત અધિનિયમની ઉપર જણાવેલ તારીખો પરના ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે વાંચવામાં આવે છે. અહીં ઉલ્લેખિત ઋણલેનાર(ઓ) / ફાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) ખાસ કરીને અને સામાન્ય રીતે જાહેર જનતાને અહીંથી ઉપરોક્ત સ્થાવર મિલકત

(ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને ઉપરોક્ત સ્થાવર મિલકત (ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથેનો કોઈ પણ વ્યવહાર એચડીએફસીના મોર્ગેજને આધિન રહેશે.

ઋણલેનાર(ઓ) / કોનૂની વારસદારો/કાનૂની પ્રતિનિધિ(ઓ) ધ્યાન સુરક્ષિત સંપત્તિ/ઓ ને રિડીમ કરવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જાગવાઇઆ પર આમીત્રત કરવામાં આવે છે. પંચનામાની નકલો દોરવામાં આવી હોય અને માલ સુચિ કરવામાં આવેલ હોય તે અન્ડરસહી કરેલ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હોય છે, અને ઉક્ત ઋણલેનાર(ઓ) / કાનૂની

વારસદાર(ઓ) / કાનૂની પ્રતિનિધિ (ઓ) ને ઓફિસના સામાન્ય કલાકો દરમિયાન કોઈ પણ કામકાજના દિવસે નીચે સહી કરાયેલ પાસેથી સંબંધિત નકલ એકત્રિત કરવા

તારીખ: ૦૫.૦૮.૨૦૨૫ સ્થળ: અમદાવાદ

એચડીએફસી બેંક લિ. અધિકૃત અધિકારી

રજિસ્ટર્ડ ઓફિસ: એચડીએફસી બેંક લિમિટેડ, એચડીએફસી બેંક હાઉસ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ (વેસ્ટ).

મજબૂત કામગીરીના પગલે

# અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના આઉટલુકમાં સુધારો કરાયો

અદાશી ગ્રુપની ત્રણ મુખ્ય મૂકે છે. એન્ટિટીઝના આઉટલુકમાં સુધારો કરવામાં આવ્યો છે. જે તેની મજબૂત કામગીરી અને ભંડોળની મજબૂત પહોંચને પ્રતિબિંબિત કરે છે. ફોકસમાં રહેલી એન્ટિટીઝમાં અદાણી કા ર ણ ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સમાવેશ થાય છે. ગ્રુપના ઓપરેશન્સની વ્યાપક સમીક્ષા અને યુએસ એસઈસી તપાસની અસરને પગલે આ સુધારા

લિમિટેડનું નકારાત્મકથી સુધારીને સ્થિર કરવામાં આવ્યું છે. જયારે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડન ંનકારાત્મકથી હકારાત્મકમાં અપગ્રેડકરવામાં આવ્યું છે. તેવી જ રીતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રિસ્ટ્રિકટેડગ્રુપ રનું આઉટલુક નકારાત્મકથી સુધરીને સ્થિર કરવામાં આવ્યું છે. આ ફેરફારોબાહ્ય પડકારો હોવાછતાં અદાણી ગ્રુપની સ્થિતિસ્થાપકતા

પ્રદર્શન મજબૂત રહૃાું છે. પ્રમોટર્સ રહી નથી.

આરોપો ને ભાંડો ળની છે. વધુમાં

કરવામાં આવ્યા છે. અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ આઉટલુક યુએસ કેસમાં અદાણી સ્થળ : અમદાવાદ

થતી જણાઈ કરારો પણ અકબંધ રહૃાા એ ન્ટિટીઝને જ રૂરી મંજૂરીઓ મળતી રહી છે.

અદાણી ગ્રુપનું ઓપરેશનલ

સામે યુએસ એ સઈસીના પહોચ અથવા ખર્ચ પર કોઈ નોંધપાત્ર અસર નથી. મુખ્ય

ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અનેતેમની વિરૂધ્ધ તપાસ ચાલી

સંખ્યામાં પ્રાઈમ ફ્રેશ લિમિટેડ CIN: L51109GJ2007PLC050404

**૨૪૪૨૦૦ ઓફિસ: ૧૦**૨, સંસ્કાર-૨, કેતવ પેટ્રોલ પંપ પાસે, પોલીટેકનિક રોડ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫, ગુજરાતે Phone : +91-79-40320244 Email : info@primefreshlimited.com; Website : www.primefreshlimited.com;

### ફીઝીક્લ શેરના ટ્રાન્સફર વિનંતીઓના પુનઃસ્થાપન માટે ખાસ વિન્ડો

સેબી પરિપત્ર ક્રમાંક SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 તારીખ ૦૨ જુલાઈ, ૨૦૨૫ અનુસાર, શેરધારકોને જાણ કરવામાં આવે છે કે, ૧ એપ્રિલ ૨૦૧૯ પહેલાં દાખલ કરાયેલા અને દસ્તાવેજો / પ્રક્રિયામાં ખામીને કારણે અથવા અન્યથા નકારવામાં આવેલા / પરત કરવામાં આવેલા/ ધ્યાનમાં ન લેવામાં આવેલા ટ્રાન્સફર ડીડના પુનઃસ્થાપન માટે જ એક ખાસ વિન્ડો ખોલવામાં આવી છે. છુટછાટો અને પુનઃસ્થાપનની આ સુવિધા ૭ જુલાઈ, ૨૦૨૫ થી ૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી વીજ ખરીદી ઉપલબ્ધ રહેશે. શેરધારકોને વિનેતી કરવામાં આવે છે કે તેઓ આવા કેસ RTA માં દ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં નીચેના સરનામે ફરીથી દાખલ કરેઃ

બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટઃ પ્રાઇમ ફ્રેશ લિમિટેડ) સરનામું : ઓફિસ નંબર S6-૨, દૃદ્ધો માળ, પિનેકલ બિઝનેસ પાર્ક, આહુરા સેન્ટરની બાજુમાં, મહાકાલી ગુફાઓ રોડ, અંધેરી પૂર્વ, મુંબઈ - ૪૦૦૦૯૩, મહારાષ્ટ્ર, ઈન્ડિયા.

કંપનીની વેબસાઇટ www.primefreshlimited.com, આ ખાસ વિન્ડો ખોલવા િવ િવ ધ સંબંધિત વિગતો સાથે અપડેટ કરવામાં આવી છે અને જો કોઈ હોય તો વધુ વ્યવસાયો માં અપડેટ્સ તેમાં અપલોડ કરવામાં આવશે.

KYC વિગતો અપડેટ કરો અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળમાં

ટ્રાન્સફર ટાળવા માટે ફીઝીકલ શેરનું ડિમેટરાઈઝેશન કરો ફીઝીકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની KYC વિગતો અપડેટ કરે અને સેબી નિયમોનું પાલન કરીને તેમના ફીઝીકલ શેરને રેટિંગ ધરાવતી ડિવિડન્ડ ખાતાઓનો દાવો કરવાની પણ સલાહ આપવામાં આવે છે, નહીં તો કં પત્તીઓ એ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ અનુસાર, સાત વર્ષની સમાપ્તિ પછી સ્પષ્ટતા કરી છે ઉપરોક્ત ડિવિડન્ડ અને સંબંધિત શેર રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ ("IEPF") માં ટ્રાન્સફર કરવામાં આવશે.

એ સઈસી તારીખ: ૦૫-૦૮-૨૦૨૫

પ્રાઈમ ફેશ લિમિટેડ વતી સહી/- જાસ્મીન દોશી કંપની સેક્રેટરી અને પાલન અધિકારી M.No. A3602

Regd. Office: Block No. 1557, Village - Moti-Bhoyan, Kalol-Khatraj Road, Taluka - Kalol, Gandhinagar, Gujarat, 382721. Website: www.srmtl.com, Email: cslegal@srmtl.com, CIN No. L25200GJ1993PLC020880

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2025

		Quarter ended	0	10 0000000 1 Danie	Year ended
Sr.No	Particulars	30/06/2025 (Unaudited)	Quarter ended 31/03/2025 (Audited)	Quarter ended 30/06/2024 (Unaudited)	31/03/2025 (Audited)
1	Total Income	5,684.87	5,935.58	4,330.80	20,850.78
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	987.27	708.86	419.77	2,183.80
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	987.27	708.86	419.77	2,183.80
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	734.72	3,659.63	419.77	5,134.5
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	727.96	3,692.72	421.70	5,045.94
6	Equity Share Capital (Face Value Rs.5/- each)	6,673.40	6,673.40	6,673.40	6,673.40
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet	-			8,644.44
8	Earnings per Share (Basic & Diluted) (Face Value Rs.5/each)				
	Basic EPS     Diluted EPS	0.53 0.53	2.72 2.72	0.29 0.29	3.70 3.70

Notes a) The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on August 05, 2025. The statutory auditors of the company have carried out review of aforesaid results as per

Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The Unaudited Financial Results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent

c) The above is an extract of the detailed format of Audited Financial Results for Quarter and Year ended 30th June, 2025 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and website of the company (www.srmtl.com).

Place: Moti Bhoyan Date : August 05,2025



By Order of the Board of Directors For, Shree Rama Multi-Tech Limited Shailesh K. Desai **Managing Director** DIN:01783891



























